

કલ્યાણ, મુંબઈ ખાતે આવેલ પડઘા પોલીસ સ્ટેશનમાં થયેલ મોબાઈલ લેપટોપ વિગેરેની ચોરીના

આરોપીઓને ગણત્રીના કલાકોમાં તમામ મુદ્દામાલ સાથે ઝડપી પાડતી સુરત શહેર ક્રાઈમબ્રાંચ

તા:-૧૪/૦૭/૧૮ ના રોજ કલ્યાણ ખાતે આવેલ પડઘા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ વેરહાઉસ (ગોડાઉન) માંથી ૧.૩૨ કરોડના મોબાઈલ લેપટોપ વિગેરે રાત્રીના ચોરી થતા પડઘા પો.સ્ટે.ગુ.ર.નં. ૧૭૧/૨૦૧૮ IPC કલમ ૪૫૪,૩૮૦ મુજબનો ગુન્હો દાખલ થયેલ તપાસ દરમ્યાન વેરહાઉસ(ગોડાઉન)માં નોકરી કરતા રાહુલ શાક્ય અને તેના સાગરીતોએ ચોરી કર્યા બાદ, સુરત શહેર ખાતે આવી છુપાયેલ હોવાનું જાહેર થતાં મુંબઈ પોલીસે સુરત ક્રાઈમબ્રાંચનો સંપર્ક કરી હકિકત જણાવતા ક્રાઈમ બ્રાંચના અધિકારીઓની સુચનાથી પો.ઈ.શ્રી. પી.એલ.ચૌધરીનાઓએ ટીમ સાથે આરોપીઓને શોધી કાઢવા માટે વર્કઆઉટ શરૂ કરેલ દરમ્યાન તેઓને મળેલ બાતમી આધારે પો.સ.ઈ.સી.એચ.પનારા સહિતની ટીમ આરોપીઓ (૧) રાહુલ સુબેદ્રસિંહ શાક્ય ઉવ-૨૫ રહે-એ/૧/૭૦૪, મંગેસીસીએ ફેજ-૨, સુદામા મિસ્ત્રીના મકાનમાં ભાડેથી કલ્યાણ (મુંબઈ) મુળ:- રહે-છાછા થાના ભોગવા જી.મેનપુરી (યુ.પી) (૨) આશિષકુમાર અયોધ્યા પ્રસાદ ઉવ-૨૭ રહે-છાછા થાના ભોગવા જી.મેનપુરી (યુ.પી) (૩) કુલફસિંહ ઠાકુરદાસ વર્મા ઉવ-૨૫ રહે-ગામ:-ઉમરીહાર પો.સ્ટ રહે-છાછા થાના ભોગવા જી.મેનપુરી (યુ.પી) નાઓને સુરત રેલ્વે સ્ટેશન નજીક આવેલ સબરસ હોટલ સામેથી પકડી લીધેલ.

આ આરોપીઓની પુછપરછમાં આરોપી રાહુલ શાક્યા બી.એસ.સી.આઈ.ટી.ભણેલ હોય, આ વેરહાઉસ (ગોડાઉન)માં કામ કરતી આઈ.ટી.ટીમમાં નોકરી કરતો આવેલ હતો કેટલાક સમયથી મેનેજર તરફથી તેને વધુને વધુ કામ અને જવાબદારી સોંપવામાં આવતી હોય, જેથી તેણે પગાર વધારવાની માંગણી અવાર નવાર કરવા છતાં પગાર ન વધારતા આર્થિક સંકળામણમાં હોય અને વેરહાઉસની ભૌગોલીક પરિસ્થિતિથી માહિતગાર હોય ચોરી કરવા માટે કાવત્રુ ઘડી આરોપીઓએ પોતાના વતનથી ટિકીટ કાઢી હવાઈ માર્ગે બોલાવી કરેલ પ્લાન મુજબ પ્રથમથી જ સહ આરોપી આશિષ પ્રસાદને વેરહાઉસમાં પ્રવેશ કરાવી દઈ રાત્રીના અઢી વાગ્યાના સુમારે વેરહાઉસ બંધ થયા બાદ કરેલ પ્લાન મુજબ આશિષ વેરહાઉસના પાછળનો દરવાજો તોડી બહાર રહેલ બન્ને આરોપીઓ ધુસી ત્રણેય આરોપીઓએ કિમતી મોબાઈલ ફોન લેપટોપ વિગેરે ચોરી કરી મુદ્દામાલ સાથે ટ્રેન મારફતે સુરત રેલ્વે સ્ટેશન વિસ્તારમાં ફરતા અને ચોર મુદ્દામાલ વગે કરવા માટે ગ્રાહકો શોધતા પરંતુ સુરત ખાતે કોઈ ગ્રાહક ન મળતા સુરત છોડી બહાર નાશી જવાની પેરવીમાં હતા દરમ્યાન મળેલ બાતમી આધારે ત્રણેય આરોપીઓને ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી પાડી આરોપીઓને કબ્જો મુંબઈ પોલીસને સોંપવા તજવીજ કરેલ.